

૯) ગત બેઠકની ભલામણ ક્રમ નં.(૧૫) Temple Management પુસ્તક પ્રકાશનની વિગતે ચર્ચા થઈ. સંશોધન અધિકારીએ જણાવેલ કે આ ગ્રંથની બે સમીક્ષકશ્રીઓએ સમીક્ષા કરી સમીક્ષા પત્રો મોકલી આપેલ છે. બે પૈકી એક રીપોર્ટ સંપૂર્ણપણે નેગેટીવ છે અને અન્ય રીપોર્ટમાં પણ ઘણાં દોષોની ચર્ચા કરેલ છે. જેની સમિતિએ નોંધ લીધી. આ રીપોર્ટ અનુસાર સંશોધન (સૂચવેલ સુધારા-વધારા) બાદ Temple Management ગ્રંથ પ્રકાશન હેતુ ફરી સ્વીકારવા સમિતિ ભલામણ કરે છે.

(૧૦) સમિતિ સભ્ય ડૉ. શત્રુઘ્ન પાણિગ્રહિએ સમિતિ સમક્ષ રજૂઆત કરી. તેમણે સમિતિને વિનંતીપૂર્વક કહ્યું કે, તેમણે એક ગ્રંથ અત્રેથી પ્રકાશિત કરવા સોફ્ટ કોપીમાં તૈયાર કરેલ છે, પરંતુ હજુ સુધી આવેદન પત્ર આપી પ્રકાશન હેતુ પ્રકાશન વિભાગમાં જમા કરાવેલ નથી. ટૂંક સમયમાં તેઓ તેમનો ગ્રંથ શકુનસૂક્તમ્ (વેદ) જમા કરાવશે. પ્રકાશનની અગ્રિમ કામગીરી હેતુ સમિતિએ નીચેની વિગતે બે સમીક્ષકશ્રીઓનાં નામ સૂચવેલ છે.

સમીક્ષક ૧ - પ્રો. શ્રી કિશોર મિશ્ર, સંસ્કૃત વિભાગ, વિનયન સંકાય, બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી.

સમીક્ષક ૨ - પ્રો. રામરાજ ઉપાધ્યાય, વેદ વિભાગ, શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાપીઠ, નવી દિલ્હી.

(૧૧) ક્રમ નં. (૮) મુજબ બાકી બજેટની રકમ રૂ. ૪,૨૫,૭૩૧/- ની મર્યાદામાં હાલમાં પુસ્તક પ્રકાશનોના ક્રમમાં International MOU અંતર્ગત વૈયાકરણસિદ્ધાન્તભૂષણમ્ (દ્વિતીયો ભાગ:), યુનિવર્સિટી ડાયરી-કેલેન્ડર-૧૯૨૨-૨૦૧૯, સંસ્કૃતવાઙ્મયે શિવતત્ત્વમ્, શોધજ્યોતિ: (અંક-૧), Error Analysis in Modern Sanskrit Literature, બારીન્દ્રકુમાર ઘોષ:, જગતીવિંશતિકા અને વેદાન્તપરિભાષાને રાખી પુસ્તક પ્રકાશનની સમિતિ ભલામણ કરે છે.

અધ્યક્ષ સ્થાનેથી

(૧૨) FIP, પોંડીચેરી સાથે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ વચ્ચે થયેલ International MOU અંતર્ગત વૈયાકરણસિદ્ધાન્તભૂષણમ્ ગ્રંથનાં બીજા ભાગને પ્રકાશિત કરવાની ચર્ચા થઈ. ગત E.C.માં Special Caseમાં પોંડીચેરી સ્થિત અરવિંદ પ્રેસમાંથી Estimate મેળવી બીજો ભાગ પ્રકાશિત કરવા સમિતિ ભલામણ કરે છે.

(૧૩) સંશોધનગ્રંથમાલા અંતર્ગત પ્રકાશિત કરવામાં આવતાં Ph.D. Thesisની વિગતે ચર્ચા થઈ. માન. કુલપતિશ્રીએ સ્પષ્ટ આદેશ કર્યો કે સંશોધનગ્રંથમાલા અંતર્ગત પુસ્તકરૂપે પ્રકાશિત થનાર Ph.D Thesisના કિસ્સામાં સંશોધકને પ્રતિ પૃષ્ઠ કોઈ પણ પ્રકારનો પુરસ્કાર/માનદેય ચૂકવવાનો રહેતો નથી. જેની સાથે તમામ સમિતિ સભ્યોએ સહમતિ દર્શાવી. આગળ જણાવતાં માન. કુલપતિશ્રીએ કહ્યું કે જ્યારે અત્રેની યુનિવર્સિટીએ Ph.D.ની ઉપાધિ આપી જે તે સંશોધકને તેણે કરેલા સંશોધન કાર્ય બદલ Recognition આપી દીધેલ છે. આ ઉપરાંત જે તે સંશોધકે Ph.D. Thesis લખવા UGC JRF મેળવેલ છે. આમ, એક જ કાર્ય બદલ જ્યારે UGC એ Fellowship પણ આપેલ છે તથા અત્રેની યુનિવર્સિટીએ Ph.D.ની ઉપાધિ પણ આપેલ છે. આવા કિસ્સામાં સંશોધક પોતાનો Ph.D. Thesis જ્યારે પુસ્તકરૂપે પ્રકાશિત કરે છે તેવા કિસ્સામાં કોઈ પણ પ્રકારનો પુરસ્કાર ચૂકવવાનો રહેતો નથી. નહીંતર આ ત્રીજો લાભ યુનિવર્સિટી આપી રહી છે એમ સાબિત થાય છે. એક જ સંશોધન કાર્યને બે જગ્યાએથી સરકારી આર્થિક લાભ આપી શકાય એમ નથી.

(૧૪) પ્રકાશન સમિતિએ સંશોધનગ્રંથમાલામાં પુસ્તકરૂપે પ્રકાશિત થનારા Ph.D. Thesisના સંશોધકને કોઈ પણ પ્રકારનો પુરસ્કાર/માનદેય ન ચૂકવવામાં આવે તથા તેમનાં પુસ્તકની ૨૦ નકલો નિ:શુલ્ક તેમને આપવા સમિતિ ભલામણ કરે છે.

(૧૫) વધુમાં, સંશોધનગ્રંથમાલા-1 રૂપે પ્રકાશિત થયેલ કૈવલ્યદીપિકા ગ્રંથના સંશોધકને ચૂકવવામાં આવેલ પુરસ્કાર નિયમ વિરૂધ્ધ હોઈ તે વિશે શું કાર્યવાહી કરવી તે આગામી A.C./E.C.માં લઈ ચર્ચા કરી યોગ્ય નિર્ણય થઈ આવવા પ્રકાશન સમિતિ ભલામણ કરે છે. આ બાબતને આગામી A.C./E.C રજૂ કરવા સમિતિ ભલામણ કરે છે.



(૧૬) હવેથી Ph.D Thesis પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનાં કિસ્સામાં સંશોધક સાથે કરવાનાં થતાં Publication Agreementમાં "સંશોધનગ્રન્થમાલામાં પુસ્તકરૂપે પ્રકાશિત થનારા Ph.D. Thesisનાં સંશોધકને કોઈ પણ પ્રકારનો પુરસ્કાર/માનદેય ચૂકવવામાં આવશે નહીં" તેમ સ્પષ્ટ રૂપે લખવા સમિતિ ભલામણ કરે છે.

(૧૭) વધુમાં, પ્રત્યેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ બે જ Ph.D. Thesis સંશોધનગ્રન્થમાલા અંતર્ગત પુસ્તકરૂપે પ્રકાશિત કરવા સમિતિ ભલામણ કરે છે.



(ડૉ. કાર્તિક પંડ્યા)
સંશોધન અધિકારી